

Registered Office: A - 603, Shapath IV, S. G. Road, Ahmedabad-380 015, Gujarat, INDIA.

Tel.: +91-79-40307050 - 59 www.freshtrop.com info@freshtrop.com

CIN::L15400GJ1992PLC018365

Date: May 30, 2022

To, BSE LIMITED Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai - 400001

SUB: NEWSPAPER ADVERTISEMENT FOR PUBLICATION OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH 2022.

REF: FRESHTROP FRUITS LIMITED - SECURITY CODE - 530077 - SECURITY ID - FRSHTRP

Dear Sir / Madam,

Pursuant to the provisions of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith extracts of the Audited Financial Results for the year ended March 31, 2022, approved by the Board of Directors of the Company at their meeting held on Saturday, 28th day of May 2022 published in following newspapers.

- Business Standard, Ahmedabad (English Language)
- 2. Jai Hind, Gujrati

This is for your information and records.

Thanking You,

Yours faithfully,

FOR FRESHTROP FRUITS LIMITED

Rohit Rawat

(Company Secretary)



WELTERMAN INTERNATIONAL LIMITED

CIN: L51100GJ1992PLC017613 Regd. Office & Factory: Plot No. 1135, At & Post: Lamdapura, Lamdapura Road, Tal. Savli, District Vadodara - 391 775. Ph.: (0265) 2310250/ 251 lterman baroda52@gmail com Website: www.welterman.com

Extract of Statement of Standalone Audited Financial Results for the Quarter & Year ended $31.03.202^{\circ}$

(₹ in Lakhs except per share data							
Sr. No.	Particulars	Quarter Ended	Year Ended	Corresponding Quarter ended			
		31.03.2022	31.03.2022	31.03.2021			
1	Total Income from Operations	201.34	379.40	54.07			
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	125.00	143.91	-6.09			
3	Net Profit/(Loss)for the period before tax (after Exceptional and/or Extraordinary items)	125.00	143.91	-6.09			
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	125.00	143.91	-6.09			
5	Total Comprehensive Income for the period [Comprising profit for the period (after tax)and other Comprehensive Income (after tax)]	125.00	143.91	-6.09			
6	Equity Share Capital	444.13	444.13	444.13			
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-1,623.21	-			
8	Earnings Per Share (of Rs. 10/- each (for continuing and discontinued operations Basic & Diluted	2.81	3.24	-0.14			

Note: The above is an extract of the detailed format of Quarter & Year Ended Finacial Results Filed with the Stock Exchange under Regulation 33 of SEBI (LODR) Regulation 2015. The Full Format of the Quarter & Year ended Financial Results are available on the website of BSE Ltd. at www.bseindia.com and on the Company's website at www.welterman.com

For Welterman International Limited

Date: 28.05.2022 Place: Vadodara

Sd/ Mansur Dhanani DIN: 08814878

TATA CAPITAL HOUSING FINANCE LIMITED Regd. Office:- 11th Floor, Tower A, Peninsula Business Park Ganpatrao Kadam Marg, Lower Parel, Mumbai 400013. CIN No. U67190MH20 PLC187552

POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY) (As per Rule 8(1) of the Security Interest Enforcement Rules, 2002)

Whereas, the undersigned being the Authorized Officer of the TATA Capital Housing Finance Limited, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred unde section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice dated as below calling upon the Borrowers to repay the amount mentioned in the notice within 60 days from the date of the said notice.

The borrower, having failed to repay the amount, notice is hereby given to the borrower, i particular and the public, in general, that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act read with rule 8 of the said Rules.

The borrower, in particular, and the public in general, are hereby cautioned not to deal wi the property and any dealings with the property will be subject to the charge of the TATA Capital Housing Finance Limited, for an amount referred to below along with interest thereon and penal interest, charges, costs etc. from date of demand notice.

The borrower's attention is invited to provisions of sub-section (8) of Section 13 of the Act, in espect of time available, to redeem the secured assets.

Loan	Name of Obligor(s)/ Legal Heir(s)/	Amount as per	Demand Notice Dt.
A/c No.	Legal Representative(s)	Demand Notice	Date of Possession
10203725	Amit Gupta (Borrower),	Rs.	27-12-2021
&		8,93,873/- &	25-05-2022
10247731		Rs. 1,46,844/-	Symbolic Possession

Description of the Secured Assets/Immovable Properties/ Mortgaged Properties All the rights, piece & parcel of Immovable property bearing Plot No. 356 (old Plot No. 312) area admeasuring 480 Sq. Foot i.e. 44.592 Sq. Meters I.e. 53.33 Sq. Yard, along with undivided share proportionate share in the underneath land of the building and all interna and external rights thereto of the premises/campus known as "SAI BHUPAT ROW HOUSE constructed on non-agricultural land for residential use bearing Old Survey No. 11/1. Block No. 16, area admeasuring 62,827 Sq. Meters, Situate at Moje Village: Pali, Sub-District Choryasi, District; Surat of Gujarat. Bounded as follows:- East by : Plot No. 439, West by 6 Meters Road, North by: Plot No. 355, South by: Plot No. 357.

10310341	Sumitra Devi (Co-Borrower)		25-05-2022 Symbolic Possessio
Descriptio	n of the Secured Assets/Immovable	Properties/ Mo	rtgaged Propertie

All the piece & parcel of Immovable property bearing Flat No. 507 on 5th floor in Tower A-6 (as per passing plan A-3) of which Super built up area admeasuring 503.32 sq. foot and built up area 31.60 sq. mtr., Along with undivided share and proportionate share in the underneath land and all Internal, External rights thereto of the campus/premises known as "SHREE TIRUPATI BALAJI TOWN", constructed on Non- Agricultural land for residential use, bearing Revenue Survey No. 140/2 of which Block No. 222, and Revenue Survey No. 170 of which Block No. 223 and Revenue Survey No. 171 of which Block no. 224 T.F Scheme of all the 3 land T.P. Scheme No. 59(unn), Final Plot No. 169, 170, 171 constructed or

all the three	final plots, Situated at Moje village: Unn, Ta	aluka.: Majura, D	ist. Surat of Gujarat
10178606	Dipteshkumar Rajendrabhai Soni (Borrower), Ropaxi Dipteshkumar	Rs. 7,19,928/-	11-12-2021 25-05-2022 Symbolic Possessio

Description of the Secured Assets/Immovable Properties/ Mortgaged Properties All the rights, piece & parcel of Immovable property bearing Flat No. 178 on 2nd Floor, in Block/Building No: "D/20" of which Super Built Up area admeasuring 760.00 Sq. Foot, I.e 70.63 Sq. Mtrs. & Built Up Area Admeasuring 47.77 Sq. Mtrs, along with undivided share proportionate share in the underneath land of the building and all internal and external rights thereto of the premises/campus known as "Raj Abhishek City Homes", constructed on nonagricultural land for residential use bearing Block No: 14 of which Total area admeasuring 80002 Sq. Mtrs., Situated at Moje Village: Pardi, Taluka: Surat City, Sub-Dist.: City (Choriyasi), District: Surat City of Gujarat.

	1021620	Ruparam Karnaram Devashi (Borrower), Anadidevi Samelaram Devashi, & Samelaram K Devashi (Co-Borrowers)	8 19 090/-	06-05-2021 25-05-2022 Symbolic Possess
--	---------	--	------------	--

Description of the Secured Assets/Immovable Properties/ Mortgaged Properties All The Piece And Parcel Of Immovable Property Bearing Flat No- A-410 On The 4th Floo Admeasuring 49-54 Sq- Meters 6-22 Sq- Meters Gallery, Along With 24-95 Sq- Meters Undivided Share Proportionate Share In The Underneath Land Of The Building And Al Internal And External Rights Thereto Of The Premises/Campus Known As "Tilak Avenue Building No- A Situated At Revenue Survey No- 175/2, Block No-160 Paiki Admeasuring 8668 Sq. Meters, & Revenue Survey No- 176/1, Block No-159 Admeasuring 809 Sq Meters, Paiki, Of Moje Village: Kansad, Ta: Choryasi, Dist: Surat-Bounded As Follows: East By : Adj- Building, West By : Adj- Passage, North By : Flat No:, 409 South By : OTS-

			•
10204275	Samelaram K Devashi (Borrower), Anadidevi Samelaram Devashi, Ruparam Karnaram Devashi (Co-Borrowers)	Rs. 7,25,776/-	06-05-2021 25-05-2022 Symbolic Possession

Description of the Secured Assets/Immovable Properties/ Mortgaged Properties All The Piece And Parcel Of Immovable Property Bearing Flat No- C-404 on the 4th Floo Admeasuring 49-54 Sq- Meters, & 6-22 Sq-Mts- Of Gallery (Balcony), Along With 24-95 Sq Meters, Undivided Share Proportionate Share In The Underneath Land Of The Building And All Internal And External Rights Thereto Of The Premises/Campus Known As "Tilal Avenue "Building No- C Situated At Revenue Survey No- 175/2, Block No-160 Paiki Admeasuring 8668 Sq- Meters, Akar 5-51 Paisa & Revenue Survey No- 176/1, Block No-159 Admeasuring 809 Sq- Meters Akar 1-32 Paisa, , Of Moje Village : Kansad, Ta Choryasi, Dist: Surat-

	Sureshchandra Ramkripal Mourya (Borrower), Madhuriben S Mourya (Co-Borrowers)	&	22-01-2022 25-05-2022 Symbolic Possession
--	---	---	---

Description of the Secured Assets/Immovable Properties/ Mortgaged Properties All the rights, piece & parcel of Immovable property bearing Bunglow No. A - 98., area admeasuring 76.48 sq. mtrs., along with undivided share proportionate share in the underneath land of the building and all internal and external rights thereto of the premises/campus known as "LAXMIVILLA TOWNSHIP", constructed on non-agricultural land for residential use bearing Sub -Plot No. 1 - H - 1 To H - 23., Situated at Moje Village Ubher - Talangpur, Taluka: Choryasi, District: Surat City of Gujarat.

Date: 25.05.2022 Sd/- Authorized Office For Tata Capital Housing Finance Limited Place : Gujarat

SAI REGENCY POWER CORPORATION PRIVATE LIMITED (In liquidation) CIN: U40105TN2002PTC055046

Regd. Office:Kalugoorani Village, Perungulam post, Ramanathpuram, Tamil Nadu -623 536 Audited financial results for the quarter and year ended 31st March 2022

SI No.	Particulars	Three months ended 31-Mar-22 Audited	Year ended 31-Mar-22 Audited	Year ended 31-Mar-21 Audited
1	Total Income from Operations	1.43	5.27	2.24
2	Loss for the period (before Tax, Exceptional			
	and/or Extraordinary items)	(17.96)	(67.39)	(1,147.70)
3	Loss for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(17.96)	(67.39)	(3,297.53)
4	Loss for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(15.26)	(56.58)	(3,297.53)
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(15.26)	(56.58)	(3,264.43)
6	Paid up Equity Share Capital	167.20	167.20	167.20
7	Reserves (excluding Revaluation Reserve)	(3,273.27)	(3,273.27)	(3,216.73)
8	Net worth	(3,106.07)	(3,106.07)	(3,049.53
9	Paid up Equity Share Capital (face value Rs.10/- each)	167.20	167.20	167.20
10	Paid up Debt Capital	3,985.26	3,985.26	3,972.00
11	Outstanding Redeemable Non convertible debentures	1,050.00	1,050.00	1,049.40
12	Debt Equity Ratio	(1.28)	(1.28)	(1.30
	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) 1. Basic:	, ,		,
13	Class A	(0.001)	(0.001)	(0.001
	Class B	(1.23)	(4.58)	(264.11
	2. Diluted:	(1.23)	(4.58)	(264.11
14	Debt Service Coverage Ratio	NA	NA	N/
15	Interest Service Coverage Ratio	NA NA	NA	N/

. Hon'ble National Company Law Tribunal, Chennai Bench (NCLT) vide its Order dated 27th March, 2019 has initiated Corporate Insolvency Resolution Process (CIRP) in the Company under Section 7 of the Insolvency and Bankruptcy Code, 2016 (IBC), pursuant to the application filed by a Financial Creditor of the Company. Mr. G.Ramachandran (IP Registration No. - IBBI/IPA-002/IP-N00167/2017-2018/10437 was appointed as Interim Resolution Professional (IRP) with effect from 27th March, 2019 under the provisions of IBC and was later confirmed as Resolution Professional (RP) by the Committee of Creditors. Subsequently, on 5th June, 2020, the RP, on instruction of Committee of Creditors, has filed an application for initiation of liquidation proceedings before the Hon'ble NCLT under Section 33 of the IBC pursuant to which the RP was appointed as the liquidator of the Company with effect from 27th April, 2021. As advised by the Stakeholders' Consultation Committee, the Liquidator endeavoured for the sale of Company on a going concern basis. Subsequent to the reporting date, the Liquidator, on 8th April 2022, issued Letter of Intent to successful bidder for acquisition of the Company on going concern basis and the sale shall stand effected subject to receipt of balance sales consideration. Since, the LOI has already been issued for sale of Company on going concern basis, the financial statements have been prepared on going concern basis and classification of borrowings into non-current and current is based on original terms of sanction. Further, since the Board of Directors cease to have effect w.e.f. liquidation commencement date in accordance with IBC), the Liquidator has approved and signed the financial results in the absence of the Board of Directors.'

2. In accordance with Regulation 52 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company has published audited financial results for the quarter and year ended 31st March, 2022. The above audited financial results were reviewed and approved by Liquidator in the absence of Board of Directors on 28 May, 2022.

The above is an extract of the detailed Annual audited financial results filed with the Stock Exchanges under Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The guarter and year ended financial results are available on the websites of the Bombay Stock Exchange.

4. Debt Service Coverage Ratio = Earnings before Depreciation + Interest and Tax Expense / Interest Expenses +Principal repayment and Interest Service Coverage Ratio = Earnings before Interest + Tax Expense / Interest

Expense. Debt capital represents debentures, term loans, redeemable preference shares. Additional disclosures (except those covered above), pursuant to Regulation 52(4) of Securities and

SI.No.	Particulars	Remarks
1	Credit Rating	BWR D
2	Asset Cover Available	The Non-convertible debentures issued are not "secured" for the purposes of the Companies Act, 2013.
3 Previous due date for the payment of interest for non-convertible debt securities		Pursuant to initiation of CIRP proceedings against the Company effective from 27th March, 2019 followed by liquidation proceedings w.e.f. 27th April, 2021, moratorium has been declared and lenders have claimed outstanding amount (including interest). Hence, thin terest accrued and due on debentures was not paid /accounted due to moratorium being imposed due to initiation of Corporate Insolvency Resolution Process (CIRP) and liquidation process under IBC against the Company.
4	Next due date for the payment of Interest	Not Applicable Ref Note.1
5	Debenture Redemption Reserve	NIL

for Sai Regency Power Corporation Private Limited **G.RAMACHANDRAN** Place: Chennai Liquidator IP Registration No. IBBI/IPA-002/IP-N00167/2017-2018/10437 Date : 28th May, 2022

FRESHTROP FRUITS LIMITED

Reg Office: A 603, Shapath IV, S. G. Road, Ahmedabad - 380015

Tel: 079 40307050 | www.freshtrop.com | CIN: L15400GJ1992PLC018365 EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER / YEAR ENDED 31ST MARCH, 2022

(NS. III LANIS)								
Particulars	Quarter ended 31 March 2022 (Audited)	Quarter ended 31 December 2021 (Un-Audited)	Quarter ended 31 March 2021 (Audited)	Year ended 31 March 2022 (Audited)	Year ended 31 March 2021 (Audited)			
Total income from operations (net)	6,506.67	1,379.47	5,729.09	17,868.81	15,043.33			
Net Profit for the period (before tax and exceptional items)	455.03	(119.14)	578.11	1,032.06	1,300.95			
Net Profit for the period before tax (after exceptional items)	455.03	(119.14)	578.11	1,032.06	1,300.95			
Net Profit for the period after tax (after exceptional items)	310.04	(77.94)	415.96	735.62	948.56			
Total Comprehensive Income for the period	7.63	7.02	21.87	17.52	(46.22)			
Profit/Loss for the period after comprehensive income	317.67	(70.92)	437.83	753.15	902.34			
Equity Share Capital	1,068.80	1,068.80	1,092.28	1,068.80	1,092.28			
Earning Per Share (Of Rs. 10 each) (after extraordinary items)								
Basic :	2.90	(0.73)	3.81	6.88	8.68			
Diluted :	2.90	(0.73)	3.81	6.88	8.68			

Capital Employed has not been identified with any of the reportable segments, as the assets used in the Company's susiness and the liabilities contracted are used inter changebly between segments. NOTE: (1) The above results were reviewed by the audit Committee and were approved and taken on record by the Board of Directors in the neeting held on May 28, 2022 (2) Revenue From Operations includes Export Incentives. (3) The Company has identified following segments as eportable segment in accordance with Ind AS-108 issued by the ICAI. Segment wise details are given to the extent possible. a) Fresh Fruits o) Food Processing (4) Previous Year's figures have been regrouped, reclassified wherever considered necessary.

For & on behalf of the Board of Directors Date: 28-05-2022 Ashok Motiani | Managing Director Place: Ahmedabad

VIRTUSA CONSULTING SERVICES PRIVATE LIMITED [CIN: U93000TN2008FTC128079]

No: 34, IT Highway, Navallur, Chennai - 600 130, Tamilnadu, India.

	Statement of Consolidated and Standaione financial results for the year ended 31 March 2022 All amounts in Indian Rupees lakhs, except share data					
			lidation	Stand		
S.No	Particulars	Financial year Ended 31 March 2022 (Audited)	Financial year ended 31 March 21 (Audited)	Financial year ended 31 March 2022 (Audited	Financial year ended 31 March 21 (Audited)	
1	Total Income from Operations	6,20,990.71	4,92,692.89	4,96,268.33	3,84,462.46	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	75,589.51	54,397.73	87,471.36	53,203.46	
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	75,589.51	54,397.73	87,471.36	53,203.46	
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	49,950.06	22,092.94	65,119.44	22,977.79	
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	49,888.39	26,794.07	64,722.01	23,637.55	
6	Paid up Equity Share Capital [face value Rs.10/- per share]	1.02	1.02	1.02	1.02	
7	Reserves (excluding Revaluation Reserve)	1,19,289.84	1,09,363.68	1,17,728.53	92,632.98	
8	Securities Premium Account	-	-	-	-	
9	Net worth	1,19,290.86	1,09,364.70	1,17,729.55	92,634.00	
10	Paid up Debt Capital/ Outstanding Debt	86,866.11	1,27,753.37	86,866.05	1,27,753.37	
11	Debt Equity Ratio	0.73	1.17	0.74	1.38	
12	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)					
	1. Basic:	4,89,610	2,16,555	6,38,301	2,25,228	
	2. Diluted:	4,12,742	1,82,556	5,38,088	1,89,868	
13	Debenture Redemption Reserve	32,066.79	19,042.90	32,066.79	19,042.90	
14	Debt Service Coverage Ratio	1.13	0.34	1.43	0.35	

15 Interest Service Coverage Ratio 8.90 4.21 10.22 For and on behalf of Virtusa Consulting Services Private Limited

> **VASU PENDYALA** Director

Place: Chennai

Place: 27th May 2022

MAθH ΩC MÃ ΘĎΣ HMA ÈH AMĎ

C[°]O /A¥¿¥′¥H°¥@sk⁄OACk₄₅©¥₅

Regd. Office: 709, C Wing, One BKC, Near Indian Oil Petrol Pump, G Block, BKC, Bandra (East), Mumbai - 400051 Email: olympicoilltd@gmail.com Website: www.olympicoil.co.in Tel: 022-6249 4444 Fax: 02226520906

ÈήMA CMMH ΣĎ MÈĎ HO ΘC ΆΔÈHΣ ΆΜΗ ΗVΔ Μ È ΓΣ ΔΜÈΔ Ψ δÈ Δ ÈΘĎÈĎ Η ΔĈ "¥Mε νως 6 8₹-&Άξ(/4xΩπx6⁵ÈΩή1

Particulars	Quarter x&oxo	ϑxξ6 x&oxo€&	Quarter È&oxo ⁼¥6∠* 6. ⊬.
	*¥6∠*6, ∠6, 6 (Audited)	⁼¥6∠*6₅ ເ∕ ₆ ₅ (Audited)	(Audited)
Total income from operations (net)	(/tdd/tcd/	1.70	16.12
Net Profit / (Loss) from ordinary activities after tax	(7.16)	(37.52)	′ 6∠©
Net Profit / (Loss) for the period after tax (after Extraordinary items)	(7.16)	(37.52)	'6⊿©
Equity Share Capital	6 Þ¿6 ∠	6 Þ ċ 6 ∠	6 Þ ¿ 6 ∠
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet	-	(2429.68)	-
of previous year)			
Earnings Per Share (before extraordinary items) (of Rs. 10/- each)			
Basic:	(0.25)	(1.00)	∠6¥'
Diluted:	(0.25)	(1.00)	LÆ¥'
Earnings Per Share (After extraordinary items) (of Rs. 10/- each)			
Basic:	(0.25)	(1.00)	LÆ¥′
Diluted:	(0.25)	(1.00)	LÆ¥′
OCS The shows to state the destillation of Countries and A		December 61 and a	dale ale e Carrelle

Ө€⁵хьThe above is an extract of the detailed format of Quarterly and Annual Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Annual Financial Results are available on the website of BSE Limited at www.bseindia.com and on website of the Company at www.olympicoil.co.in.

> For Olympic Oil Industries Limited Nipun Verma

Place : Mumbai Whole-time Direcroi Ďξ⁵хљ₆ ь³⁄ May, 2022 DIN: 02923423

ATC Telecom Infrastructure Private Limited

Regd Office: 404, 4th floor, Skyline Icon, Andheri Kurla Road, Andheri East, Mumbai - 400059, Maharashtra, India Corporate office : Plot No 14-A, Sector 18, Maruti Industrial Complex, Grugram - 122015, Tel + 91 124 4464000 CIN- U74110MH2004PTC289328; Tel + 91 22 40082700, Fax: + 91 22 40082852,

Extract of Consolidated Financial Results for the quarter and year ended March 31, 2022

	(All amounts in F	Rupees crores	, unless state	d otherwise	
SI.		Quarter ended		Year ended	
No.	Particulars	31.03.2022 (Unaudited)	31.03.2021 (Unaudited)	31.03.202 (Audited)	
01	Total Revenue from operations	2,238.61	2,066.01	9,066.15	
02	Net Profit for the period	132.02	218.44	942.36	
03	Net Profit for the period before Tax	132.02	218.44	942.36	
04	Net Profit for the period after Tax	99.45	140.73	639.35	
05	Total Comprehensive income for the period (comprising profit) after tax for the period and other comprehensive				
	income after tax)	100.89	140.53	640.20	
06	Paid up Equity	883.52	883.52	883.52	
07	Compulsory convertible debentures	1,053.96	1,053.96	1,053.96	
80	Reserves (excluding Reserve created on Amalgamation)	7,715.44	7,075.24	7,715.44	
09	Securities Premium Account (included in 8 above)	3,493.54	3,493.54	3,493.54	
10	Net Worth (6+7+8)	9,652.92	9,012.72	9,652.92	
11	Paid up Debt Capital/Outstanding Debt	8,354.50	8,531.70	8,354.50	
12	Debt Equity Ratio (11/10)	0.87	0.95	0.87	
13	Earning per share {equity shares par value of Rs.10/- (absolute amount)} - not annualised				
	- Basic (in Rs.) (absolute amount)	1.07	1.51	6.86	
	- Diluted (in Rs.) (absolute amount)	1.07	1.51	6.86	

Notes:

1. The above is an extract of the detailed format of quarterly unaudited and year ended audited consolidated financial results filed with National Stock Exchange of India Limited under Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended The full format of the quarterly unaudited and yearly audited financial results are available on the website of National Stock Exchange of India Limited at www.nseindia.com and on the Company' website at www.atctower.in.

The above consolidated financial results for the quarter and year ended March 31, 2022 have bee reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on May 26, 2022.

The above results of the Company have been prepared in accordance with the Indian Accounting Standards (Ind AS) prescribed under section 133 of the Companies Act, 2013 read with the Companies (Indian Accounting Standards) Rules, 2015, as amended, and other accounting principles generally accepted in India. The consolidated financial results represents results of the "Group" which comprises of the Company and its subsidiary ActiveX Telebroadband Services Private Limited prepared as per Ind AS 110 "Consolidated Financial State

Key numbers of Standalone Financial Statements as per Ind AS:

ı					
	SI.		Quarter	Year ended	
	No.	Particulars	31.03.2022	31.03.2021	
			(Unaudited)	(Unaudited)	(Audited)
	01	Revenue from operations	2,238.61	2,066.01	9,066.15
	02	Profit before tax	132.06	218.48	942.89
	03	Profit after tax	99.49	140.77	639.88

The figures of the quarter ended March 31, 2022 and March 31, 2021 are the balancing figures between the audited figures in respect of the full financial year and the unaudited year to date figures upto the third quarter of the relevant financial years. Previous year/periods figures have been regrouped/rearranged wherever necessary to conform to

the current period grouping. For ATC Telecom Infrastructure Private Limite

Sandeen Girotr Managing Director and Chief Executive Office Place: Singapore Date: May 26, 2022 (DIN: 5141862

RAGHUVIR SYNTHETICS LIMITED Regd. Office: Rakhial Road, Rakhial, Ahmedabad-380023 • CIN: L17119GJ1982PLC005424

Phone: 079-22911015-22911902

E-mail: info@raghuvir.com • Website: www.raghuvir.com

EXTRACT OF CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2022

	except per s	hare data)		
Particulars	Quarter	· Ended	Year Ended	
	31-03-2022 (Audited)	31-03-2021 (Audited)	31-03-2022 (Audited)	31-03-2021 (Audited)
Total Income from Operations	2956.46	6600.68	21857.48	17970.43
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	(305.01)	154.46	411.26	768.75
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(305.01)	154.46	411.26	768.75
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(179.24)	102.66	340.37	589.38
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income] (after tax)	(179.17)	103.74	343.28	589.94
Equity Share Capital	-	-	387.50	385.41
Reserves (excluding Revaluation Reserve) as per Balace Sheet of the previous accounting year	-	-	2731.89	2390.89
Earnings Per Share (of Re. 1/- each) (for continuing operations) 1) Basic : 2) Diluted :	(0.46) (0.46)	0.27 0.27	0.88 0.88	1.53 1.53

Key numbers of Standalone Results are as under :							
Particulars	Quarter Ended		Year Ended				
	31.03.2022 (Audited)	31.03.2021 (Audited)	31.03.2022 (Audited)	31.03.2021 (Audited)			
Total Income from Operations	2956.46	6600.68	21857.48	17970.43			
Profit/(Loss) Before Tax	(304.56)	154.46	411.89	768.75			
Profit/(Loss) After Tax	(178.79)	102.66	341	589.38			

NOTES

Place: Ahmedabad

Date: 27-05-2022

4.15

The above is an extract of the detailed format of Consolidated Audited FinancialResults for the Quarter and Year ended on 31/03/2022 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Consolidated and Standalone Audited Financial Results is available on the website of the Stock Exchange www.bseindia.com and on the Companywebsite at www.raghuvir.com.

The Company's AGM was held on 15thSeptember,2021, in which resolution had been passed to splitequity share of Rs.10/- eachto Re.1/- each. Record date for the transaction was 28thOctober,2021.

Effect of the split of shares has beenconsidered while calculating EPS. 3. Duringthe 3rd quarter, the Company ("the reporting company") hasacquired 51% of total shareholding of Dreamsoft Bedsheets Private Limited("the acquiree company"), therefore the acquiree company

has becomesubsidiary company of the reporting company. Therefore, the reporting companyhas complied with requirement of consolidated results for the quarter and yearended 31st March, 2022. For, Raghuvir Synthetics Limited Sunil R. Agarwal Chairman & Managing Director

DIN No.: 00265303

ભારતના રસીકરણ અભિયાનની ભરપૂર પ્રશંસા

हावोसमां मनसुખ मांउविया સાથે બિલ ગેટ્સે કરી મુલાકાત નવી દિલ્હી, તા.૨૯ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા વિષયોની એક વિસ્તૃત શ્રૃંખલા

દાવોસમાં હાલ વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક ચાલી રહી હતી. જેમાં

માંડવિયાએ બિલ ગેટ્સની સાથે ભારત તરફથી પ્રતિનિધિત્વ બેઠકની એક તસવીર ટ્વીટર કરી રહેલા ત્રણ કેન્દ્રિય મંત્રીઓ પર શેર કરી છે અને લખ્યું છે



પીયૂષ ગોયલ, હરદીપ સિંહ કે, WEF22 પર બિલ ગેટ્સની પુરી અને મનસુખ માંડવિયાએ સાથે વાતચીત કરીને આનંદ ભાગ લીધો હતો. આ થયો. બિલ ગેટ્સે ભારતે દરમિયાન માઇક્રોસોફ્ટના કોરોના સ્થાપક બિલ ગેટ્સે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથેની બેઠકમાં ભારતના રસીકરણ અભિયાનની ભરપૂર પ્રશંસા કરી હતી.

તમને જણાવી દઈએ કે, સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં પાંચ દિવસ ચાલેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક સમાપ્ત સમયગાળા દરમિયાન કરેલા થઈ ગઈ છે. કોવિડ-૧૯ કામો અને દેશમાં મોટા પાયે લગભગ આવેલા નિયંત્રણોને કારણે WEFની વાર્ષિક બેઠક અઢી કોન્ફરન્સમાં અનેક દેશોના સ્વાસ્થ્ય સેવા સાથે સંબંધિત રૂપથી ભાગ લેતા હોય છે.

મહામારીના ટ્વીટમાં મનસુખ માંડવિયાએ લખ્યું, અમે સ્વાસ્થ્ય સેવા સાથે સંબંધિત विषयोनी विस्तृत

શ્રુંખલા પર ચર્ચા કરી વખાણ્યા હતા.

પર ચર્ચા કરી, જેમાં ડિજિટલ સ્વાસ્થ્યમંત્રી મનસૂખ સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા, રોગ નિયંત્રણ પ્રબંધન અને સસ્તી અને ગુણવતાયુક્ત તબીબી ઉપકરણોના વિકાસને મજબૂત બનાવવા જેવી ચીજો સામેલ છે.

> દાવોસમાં આયોજિત થયેલી ડબલ્યૂઈએફના વાર્ષિક સંમેલનમાં ભારતમાંથી લગભગ ૧૦૦ વેપારી પ્રતિનિધિઓ અને ૧૦થી વધારે મંત્રીઓ અને મુખ્યમંત્રીઓએ હાજરી આપી. ભારતના સત્તાવાર પ્રતિનિધિમંડળની આગેવાની વાશિજય અને ઉદ્યોગ મંક્ષી પિયૂષ ગોયલે કરી હતી. તેના સિવાય પેટ્રોલિયમ અને શહેરી આવાસ મંત્રી હરદીપ સિંહ પુરી અને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ આ સંમેલનમાં સામેલ થયા. તેની સાથે કર્શાટકના મુખ્યમંત્રી બીએસ બોમ્મઈ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈ એસ જગનમોહન રેક્રીની સાથે બીજા ઘણા રાજ્યોના નેતાઓએ પણ બેઠકના અલગ અલગ સત્રમાં ભાગ લીધો.

સંમેલનમાં ભારતમાંથી મહામારીને કારણે લાદવામાં કોરોના રસીકરણના પ્રયાસોને ઉદ્યોગપતિઓએ પણ ભાગ લીધો. જોકે, આ વખતે અમુક અન્ય એક ટ્વીટમાં મનસુખ મોટા ચહેરાઓ સંમેલનમાં વર્ષ પછી યોજાઈ હતી. આ માંડવિયાએ લખ્યું, અમે સામેલ થયા નથી, જે નિયમિત



JAI HIND - AHMEDABAD

જમ્મુ-કાશ્મીરના પુંચ જિલ્લામાં કલાઇ વિસ્તારમાં ટ્રાફિક પોલીસમેન અને તેના પરિવારને લઇને જતી એક કાર રોડ પરથી લપસીને નદીમાં ખાબકતા સર્જાયેલા માર્ગઅકસ્માતમાં પોલીસમેનનું મોત થયું હતું જયારે તેના પરિવારના સભ્યો ઘાયલ થયા હતા. દુર્ઘટના સ્થળે નદીમાં પડેલી કારને સ્થાનિક બેઠકો દ્વારા દોરડાથી ખેંચીને કિનારે લાવવામાં આવી રહી છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ને લઈને આપ્યો ટાર્ગેટ

તપાસ બાદ તો પોલીસ આ યોગીએ ભાજપ કાર્યકર્તાઓને ઘટનાને આત્મહત્યા માની રહી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે ભાજપના કાર્યકર્તાઓને અત્યારથી લોકસભા ચંટણી ૨૦૨૪ની તૈયારી માટે પ્રેરિત કર્યા છે. યોગી આદિત્યનાથે કહ્યુ કે, આગામી ચૂંટણીને લઈને આપણે અત્યારથી તૈયારી કરવી પડશે. તેમણે કહ્યું કે, આપણે લોકસભાની ૭૫ સીટો જીતવાના લક્ષ્યને લઈને આગળ વધવુ છે.

રવિવારે યોગી આદિત્યનાથ બિહારી વાજપેયી સાઇન્ટિફિક કન્વેન્શન સેન્ટરમાં પાર્ટીની એક દિવસીય પ્રદેશ કાર્યસમિટીની બેઠકના ઉદ્દુઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ ૨૬ મેએ પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપની સરકારના આઠ વર્ષ પૂરા થવા પર શુભેચ્છાઓ આપી હતી.

હતી. મુખ્યમંત્રી યોગીએ કહ્યુ કે,

કરતા આદિત્યનાથે કહ્યુ કે. ૨૦૨૪ લોકસભા ચૂંટણીની જમીન આપણે અત્યારથી તૈયાર કરવી પડશે. ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ પાર્ટીને વિધાનસભા ચૂંટશીમાં સારૂ પરિશામ મળ્યું છે, તેથી આપશે ૨૦૨૪ માટે અત્યારથી આગળ વધવુ પડશે. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, ૨૦૨૪ લોકસભા ચુંટણીમાં પીએમ મોદીના નેતૃત્વને

આપણે ફરી સાબિત કરવાનું છે, તેથી ૭૫ સીટના ટાર્ગેટ સાથે અત્યારથી આગળ વધો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓ પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યુ કે, તમારા પરિશ્રમથી આ ફરી સાકાર

જયપુરના દૂદૂ વિસ્તારમાં એક જ પરિવારના પાંચ લોકોની લાશ કુવામાંથી મળતા ખળભળાટ મચ્યો

જયપુર,તા.૨૯ સમય જતાં તેમના બે બાળકો બાજુ પોલીસને ત્રણેય બહેનો ગુજરાત સહિત સમગ્ર દેશમાં પણ હતા. એટલું જ નહીં, હાલ અને બાળકોના મૃતદે હ દહેજ પ્રથાએ અનેક બે બહેનો તો ગર્ભવતી પણ શોધવામાં સમય લાગ્યો હતો. મહિલાઓનો ભોગ લેવાયો હોય હતી. પરંતુ ૨૫મી મે ત્રણેય પોલીસે સાસરી પક્ષના અમુક તેવી અનેક ઘટનાઓ બની ચૂકી સગી બહેનો માટે કાળ બનીને સભ્યોને પોતાની કસ્ટડીમાં લીધા છે. ત્યારે રાજસ્થાનમાંથી એક આવી હતી. આ દિવસે ત્રણેય છે. પોલીસને નજીકના કુવામાંથી પ્રદય હચમચી જાય તેવો એક બહેનોએ પોતાના બાળકો સાથે ત્રણેય બહેનો અને બાળકોના કિસ્સો સામે આવ્યો છે. બજારમાં જવાનું બહાનું જયપુરના દૂદૂ વિસ્તારમાં એક જ બનાવીને બહાર ગઈ હતી. પરંતુ ઓળખ કાલી દેવી (૨૭), પરિવારના પાંચ લોકોની લાશ કૂવામાંથી મળતા ખળભળાટ મચ્યો છે. આ સનસનીખેજ ઘટનાને કારણે સમગ્ર દેશમાં તેના પડઘા પડ્યા છે. પ્રાથમિક

મૃતકોમાં ત્રણ સગી બહેનો છે,

વધેઃ ઓટો કંપનીઓએ વધારો ટાળ્યો

રાહત મળવાના સંકે ત છે ખાદ્યતેલો-પેટ્રોલીયમ ચીજોના ભાવ નીચા આવ્યા બાદ હવે ઓટો

છે. જો કે, ભાવમાં કોઈ ઘટાડો હત્યા કરવામાં આવી છે. બીજી અભ્યાસ કરતી હતી. કરવામાં નહીં આવે.કેન્દ્ર સરકારે થશે. આ કાર્યસમિતી વિશ્વાસની તાજેતરમાં સ્ટીલ પર ૧૫ ટકાની લીધો છે. કારમાં સ્ટીલનો ઉપયોગ ૭૫ ટકા તથા ટ્રકમાં ૮૦ ટકા થતો હોય છે. અર્થાત વાહનોના ઉત્પાદન

નિકાસ ડ્યુટીથી ભાવમાં ૧૦થી૧૫ ટકાના ભાવ ઘટાડાના નિર્દેશ છે. તેનાથી ઓટો કંપનીઓને ફાયદો થશે. આ સ્થિતિમાં ઓટો કંપનીઓએ વાહનોમાં ભાવ વધારવાનો નિર્ણય સ્થગીત કરી દીધો છે.

જયપુરના દૂદૂ વિસ્તારમાં બનેલી ઘટનામાં મૃતકોમાં ત્રણ સગી બહેનો છે

સમય જતાં ત્રણેય બહેનો અને આઘટનાની મળતી માહિતી બાળકો ઘરે પાછી ન ફરતા પોતાની જિંદગી ગુજારવા પ્રમાણે, જયપુરના દૂદૂ પરિવારે શોધખોળ શરૂ કરી માંગતી હતી, જ્યારે ત્રણેયના વિસ્તારમાં બનેલી ઘટનામાં હતી. ત્યારબાદ ચિંતાતૂર અભણ પતિઓ દારૂના નશામાં પરિવારે પોલીસ સ્ટેશનમાં પણ તેમને ઢોર માર મારતા હતા. ર્જમના લગ્ન એક જ પરિવારમાં ફરિયાદ નોંધાવી હતી. એટલું જ તેઓ દારૂડિયા અને શંકાશીલ ખુબજનાની ઉંમરમાં થયા હતા. નહીં, પરિવારે અલગ અલગ સ્વભાવના હતા. તેઓ **કાર-વાહનોના ભાવ નહીં** ખોવાયા હોવાના પોસ્ટ પણ જીવન પસાર કરતા હતા અને

મુંબ[ુ] તા.૨લ સાસરી પક્ષ પર મોટો આરોપ અભ્યાસ કર્યા બાદ સેન્ટ્રલ મોંઘવારી ઘટાડવા માટે કેન્દ્ર લગાવીને ખળભળાટ મચાવ્યો યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો સરકારે લીધેલા કેટલાંક પગલાથી હતો. પિતરાઈ ભાઈ હેમરાજ હતો, જ્યારે તેનો પતિ માત્ર વિવિધ મોરચે લોકોને હાલ તુર્ત મીણાએ સાસરી પક્ષ પર આરોપ પાંચમાં - છકા ધોરણ સુધી જ ંલગાવતા જણાવ્યું હતું કે, મારી ભણેલો છે, જયારે મમતા એક બહેનને સાસરી પક્ષમાં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં કંપનીઓએ વાહનોમાં ભાવવધારો ખરાબ રીતે માર મારવામાં પસંદગી પામી હતી. મોટી બહેન કરવાનો નિર્ણય સ્થગીત કરી દીધો આવતો હતો. અમારી બહેનોની કાલુ બી.એ.ના અંતિમ વર્ષમાં

મૃતદેહ મળી આવ્યા છે, જેની મમતા મીણા (૨૩) અને કમલેશ મીણા (૨૦)ના રૂપમાં થઈ છે. બાળકોમાં ભોગ બનનાર હર્ષિત (૪) અને ૨૦ દિવસની એક બાળકીનો પણ સમાવેશ થાય છે. મમલા અને કમલેશ ગર્ભવતી હતી.

ત્રણેય બહેનો ભણી ગણીને જગ્યાએ પરિવારના સભ્યો વડીલોપાર્જિત જમીન વેચીને કોઈ કામધંધો કરતા ન હતા. આ ઘટના બાદ ત્રણેય મળતી માહિતી મુજબ, કમલેશે બહેનોના પિતરાઈ ભાઈએ જયપુરની મહારાણી કોલેજમાં

રેલવે સ્ટેશને ટિકીટ માટે લાંબી લાઈનમાં ઉભા રહેવાથી મુક્તિ મળશેઃ નવી સુવિધા શરૂ

પ્લેટફોર્મ ટિકીટ કે મંથલી પાસના યા 🔲 ા ટિકીટ, પ્લેટફોર્મ નવીનીકરણ માટે પ્રવાસીએ લાંબી લાઈનમાં ઉભા નહીં રહેવું પડે , રેલવેએ એક નવી ડિઝીટલ સુવિધા ઉપલબ્ધ કરી છે, જેનાથી આપ

લાઈનમાં ઉભા રહ્યા વિના ટિકીટ બુક કરાવી શકશો. નવી સુવિધા

હવે રેલવે સ્ટેશને ટિકીટ કે મોબાઈલ એપથી ક્યુંઆર કોડસ્કેન શક શે. યા □ી આ સુવિધાથી એટીવીએમ સ્માર્ટ કાર્ડને પણ રિચાર્જ કરાવી કરાવી શકે છે. આ ટિકીટ, મંથલી પાસનું સુવિધાઓ શરૂ કરાતા રેલવેએ નવીનીકરણ સહિતની યા⊡ીઓને અપીલ કરી છે કે તેઓ વધુને વધુ ડિઝીટલ મોડથી પેમેન્ટ સુવિધા ડિઝીટલ કરે અને લાંબી લાઈનમાંથી છૂટકારો માધ્યમથી ઉપલબ્ધ મેળવે.

અનુસાર રેલયા⊡ી હવે યા⊡ા ટિકીટ, ક રીને ડિ ઝીટ લ પેમેન્ટ કરી દેશમાં પ્રથમ તબક્કામાં કેટલાક ત્લેટફોર્મ ટિકીટ અને મંથલી પાસના શક શે . નવી સુવિધામાં યા □ ા સ્ટે શનોમાં આ સુવિધા શરૂ કરાઈ નવીનીકરણ માટે ઓટોમેટીક ટિકીટ ઓટોમેટીક ટિકીટ વેન્ડીંગ મશીનથી છે જે ધીરે ધીરે દેશભરમાં બધા કંપાનીઓ દ્વારા હવે વેન્ડીંગ મશીન પર પેટીએમ, ફોન સ્વિધાઓ માટે ડિ ઝીટ ¢ટેશનોમાં વિસ્તરશે.

મોંઘવારીની અસરઃ મંદીની પણ ચિંતા

માબાઇલ ફોનનું વેચાણ 30% ઘટયું: અર્થમાં સ્ટીલના ભાવની મોટી અસર થતી હોય છે. સ્ટીલમાં નવી દિલ્હી તા. ૧૯ પે, ફ્રી ચાર્જ જેવા યુપીઆઈ બેઝડ ટ્રાન્જેક શનથી પણ પેમેન્ટ કરી ટેલિવિઝન-ફ્રીઝ માર્કેટ પણ ઠંડી નવી દિલ્હી: દેશમાં મોંઘવારીની અગાઉના વર્ષની સરખામણીમાં ૩૦%

સાથે આગળ વધશે.

અસર કન્ઝમર્સ ક્યુરેબલ પર પડી રહી 🔝 જેટલું ઘટયું છે. જયારે બ્રાન્ડેડ ફોનના છે અને ખાસ કરીને જે કંપનીઓ મોડેલમાં ઘટાડાની સાથે ભાવમાં વધારો મોબાઈલ ફોન, ટે લીવીઝન અને થયો છે. રેફ્રીજ રેટ ર વિ.ના ઉત્પાદ ન એસમ્બલીંગમાં જોડાઈ છે તેઓએ જુલાઈ માસ સુધીના તેના ઉત્પાદનમાં ૧૦%નો ઘટાડો કરવાનો પ્રારંભ કરી દીધો છે.એક તરફ સતત વધી રહેલા

જુલાઈ સુધીના ઉત્પાદનમાં ૧૦% કાપ મુકાશેઃ સ્ટોક ખાલી કરવાની ચિંતા

ઉત્પાદન ખર્ચથી કંપનીઓને ભાવ વધારવાની ફરજ પડી રહી છે તો બીજી તરફ માંગમાં પણ ઘટાડો નજરે પડી રહ્યો છે. ખાસ કરીને એન્ટ્રીલેવલ એટલે કે પ્રારંભીક મોડેલ તથા મીડીયમ રેન્જના મોબાઈલની માંગ ઘટી રહી છે અને ગ્રામીણ માર્કેટમાં સૌથી મોટો ઘટાડો જોવા મબ્યો છે તો બીજી તરફ ૯થી૧૫% વધી ગયા છે.

મોટાભાગની બ્રાન્ડેડ કંપનીઓ પણ આ ભાવ વધારો તબક્કવાર તેના ગ્રાહકો પર પાસ ઓન કરે છે અને હાલ તેમાં પોતાના સ્ટોક શકય હોય તેટલો બજારમાં વેચશે તેની ચિંતા કરે છે. ચાલુ વર્ષ જાન્યુઆરી–માર્ચના કવાટરમાં મોબાઈલ ફોનનું વેચાણ

જોઇએ છે - ગૃહપતિ, રસોઇચા, ચોકીદાર

મે. જિલ્લા નાયખ નિયામક વિક્શની જાતિ કલ્લાલ ખાતુ, અમદાવાદના તા. ૧૯૧૫-૨૦૨૨ના પત્ર અન્વવે મળેલ NOC મુક્કબ શ્રી નવચેતન એક્યુકેશન ટ્રસ્ટ લોબા સંગામિત નવચેતન કુમાર છાત્રાલય, માંબા માટે भूकपति स्रोक्ष्या ધો.૧૨ પાસ /ગ્રેજ્યુએટ (કોમ્પ્યુટર ह्यो. ७ फक्ष લી. ક પાસ

ઉપરોક્ત લાવકાત ધરાવતા ઉમેદવારે જાહેરાત પ્રતિદ્વ વર્ષથી દિન-હમાં નીચેના સરનામે માપકાનના ત્રમાણપત્રો સાથે પોતાનો કોટા સાથે રજી. ખેડી પોસ્ટથી બરજ કરવી. राजामुं : मेर्ज. इस्टी श्री नवचेतन केष्युकेशन इस्ट संधावित, नवचेतन दुशर धामावय શન્દિરાતગર વિભાગ-૧, લાંભા ગામ, તા. સીટી, અમદાવાદ.

જાહેર નોટીસ

આથી જાહેર જનતા ને જણાવવાનું કે, જત ડીસ્ટ્રીક્ટ અમદાવાદ, સબ ડીસ્ટ્રીક્ટ બમદાવાદ-૨ (વાડજ) ના ઘાટલોડિયા તાલુકા ના મોર્જ ગામ ઘાટલોડિયાની સીમની સર્વે . ૨૯૨ પૈકીની જમીન જેનો સમાવેશ ટી.પી. સ્કીમ નં. ૨ માં થતાં ફાળવેલ ફાઈનલ પ્લોટ નં. ૨૪૮ ની બિનખેતીની જમીન ઉપર "દેશવાલી કો. ઓ. હાઉસીંગ સોસાયટી લીમીટેડ" ના નામથી ઓળખાતી સોસાયટીમાં આવેલ ટેનામેન્ટ નં. બી-૨, વાળી મિલકત અંગેનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી અમારા અસીલે અમારી પાસે કરેલ છે. વધુમાં તે મિલકત અંગે અગાઉના માલિકો વચ્ચે તા. ૨૮-૫-૧૯૮૫ ના રોજ થયેલ અસલ વેચાણ દસ્તાવેજ નં. ૯૧૪૦ અને સોસાયટી દ્વારા આપવામાં આવેલ અસલ શેર સર્ટીફ્રીકેટ નં. ૧૨૬ (૧૯૬)(શેર નં. ૯૭૬ તો ૯૮૦) ખોવાડી ગયેલ / ગુમ થઈ ગયેલ છે. તેથી તે મિલકત કે તેના કોઈપણ ભાગ ઉપરમિલકતના માલીક સિવાય નાણાંકીય સંસ્થા, બેંક, કોર્પોરેશન, કંપની, પેઢી કે સંસ્થા કે કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો હક્ક, હીત હિસ્સો, સંબંધ, લાગભાગ, ભાગીદારી, દાવો, અલાખો, બોજો,ગીરો, લીયન, ચાર્જ હોય કે અન્ય હક્ક જેમ કે લીઝ, લાયસન્સ, કબજો, ભોગવટો, વડા જાવા વર્ષ્યા ગાંછ (તરફ ઇલેક ટ્રોનીક ઉત્પાદ નોના ભાવ પોષાતો હોય તો તેઓએ તે અંગેની જાણ આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન સાત (૭) માં દસ્તાવેજી પરાવા સહિત લેખિતમાં અમોને રજીસ્ટર્ડ પોસ્ટથી નીચે દર્શાવેલ સરનામે જાણ કરવી.જો તેમ કરવામાં નહીં આવે તો સદર મિલકત કે તેના કોઈપણ ભાગ પરત્વે અન્ય કોઈનો કોઈ જ હક્ક, હીત, હિસ્સો, સંબંધ, લાગભાગ, ભાગીદારી, દાવો, અલાખો, બોજો, ગીરો, લીયન, ચાર્જ હોય કે અન્ય હક્ક નથી અને હોય તો તે તમામ રાજીખુશીથી જતા યાને કે વેવ કરેલ છે. તેમ સમજી અમો મુદ્દત વિત્યા બાદ ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની દાદ-ફરીયાદ, તકરાર ચાલશે નહીં તે બાબતની જાહેર જનતાએ તથા લાગતા વળગતા તમામે નોંધ લેવી.

> કેશવાણી એસોસીએટ્સ • સુનીલ એમ. કેશવાણી, એડવોકેટ એફ-૭૦૬/૭૦૭, ટાઈટેનીયમ સીટી સેન્ટર, સચિન ટાવરની બાજુમાં, ૧૦૦ ફુટ રોડ, સેટેલાઈટ, અમદાવાદ. (ઓ.) ૦૭૯-૨૬૯૩૪૩૪૩ (મો.) ૯૮૯૮૯૨૫૩૯૯

ફેડબેંક ફાઇનાન્શિયલ સર્વિસિઝ લિ. હરાજી નોટિસ

નિકાસ ડયુટી લાદ વાનો નિર્ણય કરનારા સંબંધિત ત્રાહકોના ખાતાઓના (નીચે આપેલ વિગત) સોનાના ઘરેલાંની હરાજી કરવાનું નક્કી કર્યું છે. હરાજી નીચે આપે કરવારા માત્રાલ માહારાવા માત્રાલવામાં (માન્ય ભારત માત્રાલ પ્રાથમાં માત્રાલ સ્વાહ કરવાયું વાંકા કર્યું છે. કરાઈ વ સંબંધિત શામાઓમાં ગુરુવાર તા. ૦૯-૦૬-૨૦૨૨ ના રોજ સવારે ૧૦.૦૦ થી બધોરે ૧૨.૦૦ વચ્ચે રાખવામાં આવશે જે હરાજી પ્રક્રિયા પતે ત્યાં સુધી ચાલુ રહેશે. અમરોલી ૦૨૬૧-૨૪૯૫૦૦૫ FEDGL0૧૩૯૦૦૦૨૧૩૦, ૦૦૦૨૪૫૦, ૦૦૦૨૭૫૪, ૦૦૦૩૦૧૮, ૦૦૦૨૨૭૫

२००२, २००२, २००२, २००२, २००२, २००२, २००२, २००२, २००२, २००२, २००२, २००२, २००२, २००२, २००२, २००२, २००२, २००२, २० २००२, ૦૦૦૦૬૭૭, ૦૦૦૦૬૮૭ બાપુનગર ૦૭૯-૨૨૭૦૨૮૮૧ FEDGL૦૦૬૭૦૦૦૧૫૨૦, ૦૦૦૧૫૩૪, ૦૦૦૧૫૪૭ બારે 9332(૪/८२૯ FEDGL01330001134 પાવળા ૦૨૭૧૧-૨૩૦૪/૩ FEDGL013000014%, ૦૦૦૨૦૯ ૦૦૦૧૮૬૮, ૦૦૦૧૯૭૧, ૦૦૦૨૦૨૫, ૦૦૦૨૦૪૭, ૦૦૦૨૦૭૮ ભગવતી માણસા ૦૨૭૬૩-૨૭૩૨૦૯ FEDGL03૪૦૦૦૦૦૯૭૬, ૦૦૦૦૮૯૮, ૦૦૦૦૯૩૮, ૦૦૦૦૯૭૪ ભાવનગર વાઘાવાડી રોડ ૦૨૭૮૨૫૬૦૯૦૫ :033f70306 FEDGL03/60000//Y, 0001f/0, 000100Y, 0000014, 0000016, 0000/3 ००००८७॥, ००००७० भोडा६०२८४४-२५२४४४ FEDGL0१५३०००३४७, ०००३४४८, ०००४१७५, ०००३४७८ ०००३२७६, ०००३३२०, ०००३३४७, ०००३३४७, ०००३४४४ और्सा ४१७३१७०३१० FEDGL०३४१००००७८३ ००००७२४, ००००७४४, ००००७६५, ००००८५५ गांधीनगर सेस्टर १६०७८-२.३२२३३८० FEDGL०१५४०००१५५४ ૦૦૦૧૫૬૭, ૦૦૦૨૧૪૪, ૦૦૦૨૧૪૬, ૦૦૦૧૫૪૩, ૦૦૦૧૫૪૭ ગાંધીયામ બેંકિંગ સર્કલ ૮૫૩૦૧૦૭૪૧ FEDGL૦૩૫૫૦૦૦૧૦૫૫, ૦૦૦૧૦૯૦, ૦૦૦૧૦૯૧, ૦૦૦૧૦૯૩, ૦૦૦૧૦૬૫, ૦૦૦૧૧૦૭ ઘાટલોડિયા ૦૭૯ ૨૭૬૦૩૧૯૯FEDGL૦૧૩૫૦૦૦૧૦૨૭ગોંડ્લ૦૨૮૨૫-૨૨૪૫૫૩FEDGL૦૩૩૬૦૦૦૨૫૨૮,૦૦૦૨૫૩૫,૦૦૦૨૫૫૫ ०००२३८८, ०००२४०३, ०००२४८० विभवनगर ०२७७२-२४२४२७ FEDGL03४८०००४८०, ००००६६० ००००६७५, ०००१२४५, ००००४४६, ००००६९६, ००००६९६, ००००४६ विशवा अ४४८६२८८८ FEDGL03140००१४८६, ०००१४४३, ०००१७३०, ०००१८३, ०००१८३, ०००१८३४ की ०२७६४-२६४५० FEDGL0330001२०1, ०००१२१७, ०००१२४२, ०००१३१४, ०००१४३६ क्कीब ०२७६४-२२४५० FEDGL0132000२१११८, ०००२१२८, ०००२१३७, ०००२१४६, ०००१८८५, ०००१८१२, ०००२०३४ अमरेश ०१२१२-२५१००५ FEDGL01४५०००१८६२, ०००१८७७, ०००२१४०, ०००२१८७ आस्याम ०१६१-२५७०८४२ FEDGL011६००००४४०, ००००२१ अक्षेतिस ग्रेड ४२७०७३७० FEDGL00४०००००३४३, ०००२१८४, ०००२२३५, ०००२२४०, ०००२३५१, ०००२३८१ धुलेरनगर ०७८-२२८०११२० FEDGL01४१०००२०६६ २००२, ०००२, ०००२, ०००२, ०००२, ०००२, ०००२, ०००२, ०००२, ०००२, ०००२, ०००२, ૦૦૦૦૫૧૭,૦૦૦૦૫૪૩,૦૦૦૦૫૪૮,૦૦૦૦૪૧૭,૦૦૦૦૪૯૦,૦૦૦૦૫૪૫,૦૦૦૦૫૪૭ મક્ષિનગર૦૭૯-૨૫૪૬૩૩૫ FEDGLOOE૮૦૦૦૧૨૦૫, ૦૦૦૧૫૧૬, ૦૦૦૧૧૭૭, ૦૦૦૧૨૨૪ માવડી મેઈન રોડ ૯૫૩૭૭૩૩૭૭ ०३०५५, ०००३०७७, ०००२३३७, ०००२३८०, ०००२४०४, ०००२४३० मહेसाम्रा ४४२६८७६३८ FEDGL03૫૭૦૦૦૦૩૯૬,૦૦૦૦૫૪૩,૦૦૦૦૫૭૨ મેમ્કો ૦૭૯-૨૨૨૦૧૩૧૦ FEDGL00૭૬૦૦૦૨૦૯૮,૦૦૦૧૫૨૭ २००२४४२ मोक्षसा ०२०७२२४, ००००४५४, ००००४४२, ००००५०३, ००००५०३, ००००५०३, ००००५०० २०००४४४, ००००७२०, ००००५५७, ००००१३५, ००००६८०, ००००७००, ००००७०२ मोरभी ०२८२-२२२२६२ FEDGL033૨૦૦૦૨૧૮૩,૦૦૦૨૨૧૭,૦૦૦૩૨૧૯,૦૦૦૨૦૩૩મોઢીટાંકી ૯૯૭૯૯૬૫૫૯૧ FEDGL0૧૧૦૦૦૦૧૯૧ FEDGL 03730009 રશ્ય, ૦૦૦૧૦ દય સાધુ વાસવાસી રોડ ૯૯૦૯ ૧૯૫૯૪ FEDGL003૮0001૯૬૭, ૦૦૦૧૯૯ ૦૦૦૧૯૯૬, ૦૦૦૨૦૬૫ સરયાસા ૯૩૮૪૦૦૯૦૬ FEDGL0૧૦૫૦૦૦૨૧૦૨, ૦૦૦૨૪૮૮, ૦૦૦૨૪૪૦, ૦૦૦૨૩૯૯ મુટેન્દ્રનગર વઢવાસ ૦૨૭૫૨-૨૨૧૩૩૩ FEDGL033૧૦૦૦૨૪૬૯, ૦૦૦૨૪૮૨, ૦૦૦૨૫૪૦ ઊંપના ૦૨૬૧-૨૨૭૭૦૦ -FEDGL01४৫०००२६७४, ०००२६৫४, ०००३१৫२, ०००३२०२, ०००३०१० वराछा ०२६१-२५४१०० EDGL018eC00110qaid(08e-12/6/set=TEDGL018/c00011e8,0001198,000119e,000116e)

0001161,0001331,0001331,0001361,0001361,0001162,0001162,0001169,0001160 DODIOD, DODIOD, DODIOLO, DODDELE, DODOER, DODOER, DODOER, DODOER, DODOER, DODOER 000689, 0000646, 0000699, 0001170, 0001171, 0001133

. જાઈ કરતા કરિયાનો કેરકાર હશે તો અમારી વેબસાઇટ www.fedfina.com પર દર્શાવવામાં આવશે. ભાગ લેનાર તમામ બીડરોને બીડ સ્વાક સત્તારીખમાં કેરકાર હશે તો અમારી વેબસાઇટ www.fedfina.com પર દર્શાવવામાં આવશે. સ્વીકાર અથવા નકાર બાબતે તેમણે બીડ જમા કર્યા બાદ જાલ કરવામાં આવશે. જે ગ્રાહક પોતાના દાગીના છોડાવવા માંગતા હોય તે શાખામાં દાગીના પ્લેજ કર્યા હોય તે શાખાનો ૦૮-૦૬-૨૦૨૨ પહેલાં અથવા/ ત્યાં સધીમાં ઉપર આપેલ નંબર પર સંપર્ક કરી શકે છે માગ પડતા નિયમો અને શરતોને આધીન રહેશે. હરાજી સંબંધિત શાખાઓમાં થશે. જો હરાજી આપેલ તારીખે કોઈ પણ કારણસર થ હીં/પૂરી ન થાય તો એ સંબંધિત હરાજી અમારી વેબસાઇટ પર વિગતો દર્શાવ્યા બાદ, પછીના કામકાજી દિવસે યોજવામાં આવશે.

તારીખઃ : ૩૦-૦૫-૨૦૨૨

Saanvi

Rogd. Office: 334, Shopper's Plaza - Y, Government Servants Co-Op. Housin Society Limitet, Opp. Municipal Market, C.G. Rose, Nantangpura. Abreelabad - 380009. Phone No.: 879-88004153. CIN: L74140GJ1881PLC084285. Email: saptharishifin與smail.com Website: www.saptharishi.in EXTRACT OF AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2022

Oscirtor Vege

No	Particulars	ended on 11/03/2022 (Audited)	ended on 15/03/2522 (Autilled)	3 months onded in the previous year 31/03/2021 (Audited)
-	Total Income from Operations	4:57	48.74	18.72
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or	9.30	an.ca	30.72
	Extraordinary items)	0.43	27.26	13.40
3	Net Profit I (Loss) for the period before tax (after Exceptional	10.33	1000	
ě	and / or Extraordinary items)	0.43	27,26	13.40
9	Met Profit / (loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items)	0.43	21.82	10.86
5	Total Comprehensive Income for the period (Comprising Profit/ (loss) for the period (after tax)		1000000	COUNTRY COUNTRY
	and other comprehensive income (after tax)	0.43	21.82	10.86
6	Paid-up Equity Share Capital	201.05	201.05	201.05
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited	10000000	ESCONO.	CONTRACTOR
	Balance Sheet of the previous year.	-	81.44	2.0
8	Earnings per Share (of Rs. 10/- eact) (for continuing operations)	22425	[10]#2#5	1624288
П	- Basic	0.02	1.09	0.54
	- Diluted	0.02	1.09	0.54

Notes : (1) The above is an extract of the detailed format of quarter and year nded Audited Financial Results filed with the stock exchange under Regulatio 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The Full forms) of the Audited Financial Results is available on the stock. Eathange website - www.mselin & on company's website - www. Sapthanishi in (2) The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in the meeting held on 28th May, 2022.

3) The company has adopted Indian Accounting Standard ("NE AS"), notified to he Ministry of Corporate Affairs with effect from 1st Agril, 2017. Accordingly the Financial Result for the Quarter and Feor ended on 31st. March, 2022 in accordance with IND-AS and other accounting principles generally accepted in India. For Saanvi Advisors Limited Place: Ahmedabad Roopesh Ved, Director - DIN: 01504998

જાણકારોનું એવું માનવું છે કે હવે કરશે લાલુ પ્રસાદે બિહારની ધરતી પર બેઠકની ખાસ વાત એ છે કે પગ મુકયા છે અને તેઓ સક્રિય તેમાં તેજસ્વી અને તેજપ્રતાપ એક મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ

રહી હતી બિહારના રાજનીતિના આ બેઠકની અધ્યક્ષતા લાલુ પ્રસાદ

બિહારની રાજનીતિ લાલુ બોલાવી છે

પ્રસાદ યાદવ વિના અધુરી રહી છે

લાલુનના ન રહેવા અને તેમના

સક્રિય ન હોવાથી બિહારની

રાજનીતિ અનેકવાર નીરસ લાગી

વિશ્વભરની ઓઈલ કંપનીઓને લાદવામાં આવે અને તેની મસમોટી આવક થઈ રહી છે. પરિભાષા શું હશે ? ક્રૂડના ભાવ ઉંચકાતા અને કુદરતી ગેસના ભાવ અંદાજે બમણા થતા અને કોમોડિટીના ભાવ અમુક બ્રિટને જ ગઈકાલે ઓઈલ એન્ડ સ્તરથી ઉપર જતા ભારતમાં ગેસ કંપનીઓ પર ૨૫% ટેક્સ ઓઈલ એન્ડ ગેસ કંપનીઓ પર લાદવાની જાહેરાત કર્યા બાદ હવે આ પ્રકારનો વિન્ડફોલ ટેક્સ આ જ તર્જ પર ભારતની ઓઈલ લાદવાની તૈયારીઓ શરૂ કરવામાં અને ગેસ કંપની કોમોડિટી આવી છે. ગુરૂવારે રાત્રે બ્રિટનના કંપનીઓ અને કૂડની પરોક્ષ અસર નાણામંત્રી રિશિ સુનાકે મોંઘવારી ધરાવતા સેક્ટર પર ટેક્સ સામે લડવા માટે રાહત પેકેજ વસૂલવાની તૈયારી મોદી સરકાર જાહેર કરવાની સાથે ઓઈલ અને કરી રહી છે.

એક અહેવાલ અનુસાર ભારત ટાઈમ વિન્ડફોલ ટેક્સ લાઘો છે. સરકારે પણ બ્રિટનની માફક છે. આ અંગે નાશામંત્રાલયમાં મળી રહ્યું છે.

નવીદિલ્હી,તા.૨૯ ચર્ચાઓ શરૂ થઈ કે ભારતમાં આ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે પ્રકારનો વિન્ડફોલ ટેક્સ કઈ રીતે

લાલુ પ્રસાદ બિહારની રાજનીતિમાં ફરી સક્રિય, પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી

લાલુ પ્રસાદે ૩૧મેના રોજ

વિધાનસભા પક્ષની બેઠક બોલાવી

છે આ બેઠક પૂર્વ મુખ્યમંત્રી

રાબડીદેવીના નિવાસ પર યોજાશે

ગેસ કંપનીઓ પર ૨૫% વન

ભારતમાં પણ વિન્ડ ફોલ સ્થાનિક ઓઈલ એન્ડ ગેસ ટેક્સની સરકાર સંભાવનાઓ કંપનીઓને અશધાર્યા અને નોન- તપાસતી હોવાના અહેવાલ બાદ બિઝનેસ પરિબળોને કારણે થનારા દેશની ઓ ઈલ એન્ડ ગેસ વધારાના નફાને ધ્યાનમાં રાખીને કંપનીઓ અને કોલસા કંપનીના વધુ ટેક્સ વસૂલવાની ઈચ્છા જાગી શેરમાં પણ મસમોટું દબાણ જોવા

પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

રિપોર્ટ અનુસાર વૈશ્વિક ક્રૂડ રહેવા માટે જણાવાયું છે.

ચર્ચા કરવામાં આવશે.

ચુંટણી રાષ્ટ્રપતિ ચુંટણી સહિતના અનેક મુદ્દા પર ચર્ચા થશે રહેવાનો આદેશ આપ્યો છે. એ યાદ રહે કે બિહારમાં હાલના દિવસોમાં રાજનીતિ ગરમ છે.સત્તા પક્ષની વાત કરીએ કે વિરોધ પક્ષની બંન્ને જુથોમાં હલચલ તેજ છે આ

પાર્ટીના તમામ ધારાસભ્યોને હાજર

બેઠકમાં સત્તા

પરિવર્તન, રાજયસભા

ચુંટણી,વિધાન પરિષદ

બધાની વચ્ચે રાજદના ધારાસભ્યોની બેઠક મહત્વપૂર્શ બની રહેશે બેઠકમાં તમામ ધારાસભ્યો હાજર રહેશે અને લાલુથી વિશેષ મંત્ર ગ્રહણ કરશે આ બેઠકમાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ,તેજ પ્રતાપ સિંહ લલિત યાદવ ભાઇ વીરેન્દ્ર ડો મુકેશ રોશન વિજય સમ્રાટ સહિત તમામ ધારાસભ્યોને ખાસ રીતે હાજર

પાર્ટી તરફથી મળતી માહિતી અનુસાર આ બેઠક ખુબ મહત્વપૂર્ણ છે.રાજદ તરફથી કહેવામાં આવ્યું છે કે આ બેઠક મેના અંતિમ દિવસોમાં બોલાવવામાં આવી છે.આ બેઠકમાં અનેક મહત્વપૂર્શ નિર્ણય લેવામાં આવશે અને આ સાથે જ શહાબુદ્દીનના સમર્થકોની નારાજગી પર પણ વાતચીત થશે આ ઉપરાંત ૧૦ જુને યોજાનાર રાજ્યસભા ચુંટણીને લઇને પણ

FRESHTROP FRUITS LIMITED Reg Office: A 603, Shapath IV, S. G. Road, Ahmedabad - 380015

Tel: 079 40307050 | www.freshtrop.com | CIN: L15400GJ1992PLC018365

					(Pris. In Lukhis
Particulars	Quarter ended \$1 March 2022 (Audited)	Quarter ended 31 December 2021 (Un-Audited)	Quarter ended 51 March 2023 (Audited)	Year ended 31. March 2022 (Audited)	Year ended 33 March 2021 (Audited)
Total records from operations (net)	4,506.67	1,379.47	5,729.09	17,969.81	15,043.33
Next Proof it for the period (before the and exceptional tierro)	455.00	(119.14)	578.11	1,032.06	1,300.95
Next People for the period before becames exceptional People	455.03	(339.14)	578.11	1.032.06	1,300.95
Not Professor the period after the Grant mongstonal items	310.04	(77.94)	415.90	735,62	948.56
Test Comprehensive Ecome for the period	7.43	7.02	21.67	17.52	(46,22)
Profit/Loss her the period after comprehensive income	317.67	(70.92)	437.83	759.15	902.84
Equity Mane Copital	1,068.80	1,068.80	1,093.28	1.068.80	1,092.28
East-ring five Street (Of No. 30 each); Caffeet mitted	rothery Autol)	1200		7.55	
Bank:	2.90	(0.73)	3.81	6.88	3.63
AND ADDRESS OF THE PARTY OF THE	2.00	00.734	9.000	1.00	10.000

Capital Employed has not been identified with any of the reportable segments, as the assets used in the Company's business and the liabilities contracted are used inter changebly between segments. NOTE: (1) The above results were reviewed by the audit Committee and were approved and laken on record by the Board of Directors in the meeting held on May 26, 2002 (2) Revenue From Operations includes Export Incombines. (3) The Company has identified following segments as reportable segment in accordance with Ind AS-106 issued by the ICAL Segment wise details are given to the extent possible, a) Fresh Fruits b) Foodiffricons and (4) Prevenus Year's Research has been represent sectionally wherever considered recessory.

Place: Ahmedabad















For & on behalf of the Board of Directors













